

September 02, 2020

To,
The Secretary,
Department of Corporate Services,
BSE Limited,
25th Floor, Phiroj Jeejeebhoy Tower,
Dalal Street, Fort,
Mumbai: 400 001

Dear Sir/Madam,

Ref: **Company Code: 539384**

Sub: **Newspaper Publication: Notice of 26th Annual General Meeting, Remote E-voting information and Book Closure etc.**

Please find enclosed herewith copies of newspaper advertisements published in Lok Mitra (Vernacular Language) and Freepress (English daily) regarding e-voting information for the 26th Annual General Meeting of the Company in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on record.

Thanking you,


Yours faithfully,

For, **Krishna Capital & Securities Limited**



Ashokkumar Agrawal
(Managing Director)
(DIN 00944735)





EDITORIAL

The inventor of the polio vaccine Jonas Salk said: "Our biggest responsibility is to be good ancestors". India is approaching a big decision; whether we will take one to two years or three to five years to vaccinate 1.3 billion people. History will judge whether we were good ancestors by this decision. The difference could be thousands of lives, millions of livelihoods, hundreds of bankruptcies, unsustainable public finances, and 2-3 lakh crore in bad loans. In recent times, the one government initiative that has physically reached a billion people is Aadhaar enrolment. In 2009, some of us were grappling

with how to enrol at speed, scale and quality. We realised that the traditional model, where the government procured thousands of enrolment kits would not cut it. We came up with a different model. The Unique Identification Authority of India (UIDAI) appointed registrars such as state governments, private and public banks, and the post office, to carry out enrolment. In turn, these registrars hired enrolment agencies from a UIDAI-approved list. The agencies bought UIDAI-approved enrolment kits directly from vendors of biometric devices. The operators of the enrolment

kits were certified through another ecosystem. Enrolment operations were quickly set up nationwide. At its peak, there were some 35,000 stations that could enrol up to 1.5 million residents a day. The reimbursement was 750 per successful Aadhaar generated. This public-private partnership is how we managed comprehensive coverage — and fast. The result: 600 million residents got their Aadhaar in four years, and a billion in 5.5 years. The response to the pandemic needs to be even faster. India is uniquely placed to offer vaccination for the entire population at speed and scale.

The experience of Aadhaar enrolment is helpful, as is the infrastructure provided by Aadhaar. Now that everyone can be authenticated online, either using Aadhaar or using mobile phones, be it by biometrics or OTP, it creates a new paradigm. For example, we can allow anytime-anywhere vaccination, where a person can walk into a vaccination station nearby, have a choice to get authenticated with Aadhaar or phone number and get a shot — all in minutes. India is the vaccine capital of the world. Serum Institute of India is the world's largest vaccine manufacturer, with a capacity to manufacture 1.2

billion vaccine doses a year. It has partnerships with vaccine makers Oxford/AstraZeneca, Novavax and Codagenix. Zydus Cadila has started Phase 2 clinical trials of its vaccine ZYCoV-D. If successful, it says it can manufacture 100 million vaccines a year. Bharat Biotech has begun Phase 2 trials of its indigenous vaccine developed with Indian Council of Medical Research and the National Institute of Virology. It says it will have a capacity of 200 million doses per year. Biological E has tied up with Johnson & Johnson. With the acquisition of Akorn India Pvt Ltd, it expects to have a capacity of one billion doses

per year. There are other firms, and other vaccines too. Sure, things remain uncertain. Some vaccines may be unsuccessful; some may require two doses or may need to be repeated after a few months. The capacities may be overstated, and some of that capacity will be exported. Even after that, it is still reasonable to assume that India will have adequate vaccine supplies at some stage. If any of the vaccines fail, the capacity earmarked for the failed vaccine can be used to manufacture a successful vaccine of the same type.

61.5k across Bihar to write exam beginning today

Patna, Altogether 818 students with paper two of Bachelor of Architecture and Bachelor of Planning have registered for Joint Entrance Examination (JEE) Main in the capital city on Tuesday. A total of 359 candidates would take exam in the first sitting while 449 students in the second sitting across 20 exam centres in the city. As per advisory issued by the National Testing Agency (NTA), candidates are allowed to carry admit card, valid identity proof, passport size photograph, transparent ball pen and personal hand sanitiser. Candidates will be provided three-ply mask at the entrance. Patna district administration on Monday said that preparation on their part have been completed for smooth conduct of examination. A senior district administration official said,

"Exam centres are responsible for following standard operating procedure issued by agency for conducting exams. We have made arrangements for crowd management outside exam centres." He said, "Adequate number of magistrates and police personnel have been deployed to prevent gathering outside exam hall. As public transport including auto-rickshaws and city buses are plying, there will be no shortage of transportation." Meanwhile, exam centres in the capital city Patna were gearing up for making pre-exam preparations. Ajay Singh, who is managing Uniconcept exam centre at Kankarbagh, said, "We have almost completed arrangements. Exam hall, computer system, doors and common surface areas have been sanitised thoroughly."

Schools, parents divided over calling senior students for academic guidance

Gurugram, With the Central government's Unlock 4 guidelines allowing students of classes 9 to 12 to visit schools on a voluntary basis from September 21 to seek academic guidance, some government schools in the city are preparing to call students on a rotational basis once the SOPs are issued by the state government. Most private schools, on the other hand, plan to continue with online classes and are not in favour of asking senior students to visit the school. Parents too continue to remain divided on the issue. While those who do not have access to smartphones and internet connection are willing to send their wards to schools, others prefer online or telephonic consultation.

As part of the guidelines, students of classes 9 to 12 can be permitted to visit schools for academic guidance with the written consent of parents, starting September 21. The standard operating procedures for this will be issued by the Ministry of Health and Family Welfare (MoHFW). While protocols for the same are yet to be issued, government schools in the city welcomed the move and said that it will help students who are unable to access online lessons.

Centre's probe into scholarship scam attack on federal structure, says Punjab CM

Chandigarh, Punjab chief minister Capt Amarinder Singh on Monday took strong exception to an inquiry being ordered into the alleged scholarship scam by the Union ministry for social justice and empowerment without consulting the state government or waiting for the chief secretary's probe report. Earlier, Union minister of state for commerce Som Prakash was quoted as saying that a departmental inquiry has been ordered by the social justice and empowerment ministry on his complaint and that he had taken up the matter with the minister concerned, Thawar Chand Gehlot. "The move is another attack on the federal structure of the Indian constitutional polity," Capt Amarinder Singh said, adding that it was aimed at eroding the state government's authority as part of the BJP-led central government's agenda to undermine the governments in all non-BJP ruled states. But, he said, his government will not succumb to such petty and motivated pressures by the BJP or any of its alliance partners, including the Shiromani Akali Dal. He pointed out that the alleged scam into which the inquiry has been ordered took place from 2015-17 under the SAD-BJP regime. The chief minister said if the intent behind the so-called central government departmental investigation was to cover up the BJP-SAD tracks in the case, it would not succeed.

SANGINITA CHEMICALS LIMITED			
(CIN: L24100GJ2005PLC047292)			
Registered Office: 301, 3rd Floor, Shalin Complex, Sector 11, Gandhinagar -382 011 (Gujarat)			
UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2020			
Particulars	Quarter ended on	Quarter ended on	Year ended on
	30-06-2020 (Unaudited)	30-06-2019 (Unaudited)	31-03-2020 (Audited)
Total income from operations	2677.03	4038.86	15978.08
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	(16.76)	114.28	450.01
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	(16.76)	114.28	450.01
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	(16.76)	82.49	336.62
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(16.76)	82.49	336.62
Equity Share Capital	1726.77	1726.77	1726.77
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	2134.25
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic & (b) Diluted	(0.10)	0.48	1.95

FOR, SANGINITA CHEMICALS LIMITED
SD/-
DINESHSINH B. CHAVADA (DIN NO. 01497977)
CHAIRPERSON & MANAGING DIRECTOR

KRISHNA CAPITAL & SECURITIES LIMITED	
(CIN: L67120GJ1994PLC023803)	
Registered Office: 403, Mauryansh Elanza, B/h. Parekh Hospital, Shyamal Cross Road, Satellite, Ahmedabad: 380015	
Phone: 079-26768572, 26768573, E-Mail: ksbspl@yahoo.in, Web Site: www.kcsl.co.in	

NOTICE OF THE 26TH ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING & RECORD DATE INFORMATION

NOTICE is hereby given that the 26th Annual General Meeting (AGM) of the Members of the Krishna Capital & Securities Limited will be held on Friday, September 25, 2020 at 4.00 P.M. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact business as set out in the notice of AGM which is being circulated for convening the AGM. In view of the continuing COVID-19 pandemic the Government of India, Ministry of Company Affairs vide its Circular No: 14/2020 Dated April 08, 2020, Circular No: 17/2020 Dated April 13, 2020 and Circular No: 20/2020 dated May 05, 2020 and also Securities and Exchange Board of India vide its circular No: SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 have permitted the holding of AGM through VC/OAVM without the physical presence of the members at a common venue in compliance with these circulars and the relevant provision of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 the AGM of the members of the Company will be held through VC/OAVM. In compliance to Section 101 of the Act read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 36 of the Listing Regulations, Secretarial Standard on General Meetings (SS-2) and in compliance with the MCA Circulars and SEBI Circular, the Notice of 26TH AGM along with the Annual Report 2019-2020 have been sent on September 01, 2020 by email to those members whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent / Depositories. The requirements of sending physical copy of the Notice of the 26th AGM and Annual Report to the Members have been dispensed with vide MCA Circulars and SEBI Circular. Members are hereby informed that the said Annual Report including AGM Notice is also available on the Company's website www.kcsl.co.in, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of Central Depositories Services Limited (CDSL) at www.evotingindia.com. In compliance with the Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and SS-2 issued by the Institute of Company Secretaries of India:

- The Company is providing its members the e-voting facility as well as e-voting facility during the AGM to its Members to cast their vote by electronic means on the Resolutions set out in the Notice of the 26th AGM;
- Day, Date and Time of commencement of remote e-voting: Tuesday, September 22, 2020 (09.00 a.m. to 05.00 p.m.);
- Day, Date and Time of end of remote e-voting: Thursday, September 24, 2020 (05.00 p.m. to 05.00 p.m.);
- Cut-off date: Friday, September 18, 2020.
- Any person, who becomes a member of the Company after dispatch of the AGM Notice by email and holding shares as on cut-off date i.e. September 18, 2020 can obtain their Sequence No. for e-voting by sending a request on ksbspl@yahoo.in and cast vote after following the instructions including instructions relating to User ID & Password as provided in the AGM Notice, which is available on the website of the Company and CDSL. However, if you are already registered with CDSL for remote e-voting then you can use your existing User ID and Password for Casting your vote;
- The Members, who will be attending the AGM through VC / OAVM and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the 26th AGM. The manner of voting through the e-voting system during the AGM for the members is provided in the AGM Notice.
- The Members are requested to note that:
 - Remote e-voting module shall be disabled by CDSL for voting after 5:00 p.m. on Thursday September 24, 2020.
 - The Members who have cast their vote through remote e-voting will be eligible to attend the AGM through VC or OAVM but shall not be entitled to cast their vote again through e-voting system available during the AGM. However, they will not be eligible to vote at the AGM.
 - Members holding share as on the cut-off date i.e. Friday, September 18, 2020, shall only be entitled to avail the facility of remote e-voting or e-voting system at the 26th AGM.

For any queries or issues relating to e-voting & attending the AGM through VC or OAVM, members may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under help section or may write to Mr. Rakesh Dalvi, Manager, CDSL, 25th Floor, A Wing, Marathon Futrex, Mafatal Mills Compound, N M Joshi Marg, Lower Parel (East), Mumbai-400 013, Phone No. 022-23058542, E-mail Id: helpdesk.evoting@cdslindia.com or contact Mr. Nitin Kunder (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543).

By Order of the Board,
For, Krishna Capital & Securities Ltd
SD/-
Ashokkumar Agrawal
Managing Director
DIN 00944735

Cameras installed at Badrinath dham for 'online darshan' amid pandemic

Dehradun, The Char Dham Devasthanam Management Board (CDMB) authorities in Uttarakhand have started work for online darshan of the Char Dham shrines for pilgrims in a bid to avoid overcrowding at the sacred temples because of the raging coronavirus disease (Covid-19) outbreak, state government officials said. CDMB authorities will allow online darshan in the revered shrines of Kedarnath, Badrinath, Gangotri and Yamunotri in a bid to keep the viral infection at bay. Ravinath Raman, chief executive officer (CEO), CDMB, said, "Initially, online darshan will be available for the Badrinath shrine, where cameras are being installed." Raman said the cameras and other equipment are being installed by a telecom company for free of cost.

"The equipment is being installed by the company as per a CSR (corporate social responsibility) initiative, but they will be owned by the board. Work has started in Badrinath and it will be followed by the Kedarnath shrine. However, the process may take a while, as the heavy equipment needed to be lugged to a higher altitude at the height of the monsoon season," said Raman. The CEO, an Indian Administrative Service (IAS) official, said that after the work is completed, images and videos of the four shrines would be live-streamed on several websites. "The live streaming will be done on the board's or the chief minister's website and also via social media platforms," he said. Raman said the online darshan initiative would be reviewed after the viral

outbreak subsides. "This is not a permanent arrangement."

SYMBOLIC POSSESSION NOTICE

ICICI Bank Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No -B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra - 400604

Whereas The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (2) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch
1.	Kishankumar Ravindrakumar Bhatt/ Ravindrakumar Tuljashankar Bhatt- LBJAM00002075646	Flat No. 304, 3rd Flr., Manali Apartment, Jampur. Estate Plan No 72, Saru Section Road, Opp Purva Heights, Plot No. 36, Sub Plot No. 36/2 36 B, Sheet No. 214, Cs No. 5427 Old CS No 1 G4, Jamnagar- 361001. August 27, 2020	Jan 31, 2020 Rs. 1365958.00/-	Jamnagar
2.	Urmilaben Kalpeshbhai Siddhpura/ Kalpeshbhai Jayantil Siddhpura- LBJAM00003488090	Plot No.322, Sub Plot No 322/1, Sitaram Park, Near Swami Vivekanand Bridge, Victoria Bridge, R.S. No.390 Paiki, T.P.S.no 5, Jamnagar-361007.. August 27, 2020	Dec 16, 2019 Rs. 1933163.00/-	Jamnagar
3.	Mehulkumar Maheshbhai Joshi/ Maheshbhai Kantilal Joshi-lbbrd0003969551/ LBRRD00003969526	Flat No. B-102, First Floor, Shreeji Villa Tower, R.S. No. 215, Block No. 183, B/h Ambika Nagar, Sevasi Canal Road, Vadodara- 390021 August 28, 2020	Feb 18, 2020 Rs. 1810460.04/-	Vadodara
4.	Bharatkumar G Parmar/ Mital Bharatsinh Parmar- LBRRD00002853414	Block No. C/26, Gurukrupa C.H.S.L., Opp Sahyog Garden, R.S. No. 638 Part, C.S. No. 4191/B, Village Gorwa, Vadodara, Gujarat-390016. August 28, 2020	Nov 30, 2019 Rs. 2860396.00/-	Vadodara
5.	Dharmeshkumar Ranjitsingh Choradia/ Rinaben D Choradia- LBRRD00002858087/ LBRRD00002858086	Bungalow No. 15, Milan Park C.H.S.L., Nr. Mahesana Nagar Garba Ground, Opp. Deluxe Society, Nizampur, R.S. No. 144, 145 (Paikae), T.P.S. No. 12, Final Plot No. 412, 413, C.S. No. 2349, 2355 And 2362 To 2371, Varodara, Gujarat- 390002. August 28, 2020	Nov 25, 2019 Rs. 30541161.00/-	Vadodara
6.	Alpesh Vasudev Gandhi/ Alps Leisue Holiday Private Ltd/ Shilpaaben Mukeshkumar Shah/ Jigneshkumar Hariharbhai Kachhiya/ Mukeshkumar Shah/ Nikhil Hasukhlal Shah- Director Of Alps Leisue Holiday Private Ltd/ Alps Leisue Holiday Private Ltd/ Director Of Alps Leisue Holiday Private Ltd/ Jigneshkumar Hariharbhai Kachhiya- Director Of Alps Leisue Holiday Private Ltd/ Alps Leisue Holiday Private Ltd - LBRRD00002074581	Unit No 1, Pushit, Near Kirti Stambh, Raj Mahal Road, Piramita Road C.S. No.3/1/B, Vibhag-B, Tikka No-14/4, Babajipura, Vadodara-390001. August 28, 2020	Dec 13, 2019 Rs. 5938219.00/-	Vadodara

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date : 02-09-2020
Place: Gujarat

Authorized Officer
ICICI Bank Limited

MAITRI ENTERPRISES LIMITED

(CIN:L45208GJ1991PLC016853)

(Regd. Office:- "Gayatri House", Ashok Vihar, Near Maitri Avenue Society, Opp. Govt. Eng. College, Motera, Sabarmati, Ahmedabad 380005)

E-mail id: compliance@maitrienterprises.com, website:www.maitrienterprises.com

Part I	Statement of un-audited Results for the Quarter Ended on 30/06/2020			
	Quarter ended		Year ended	
Particulars	3 months ended (30/06/2020)	Preceding 3 months ended (31/03/2020)	Corresponding 3 months ended in the previous year (30/06/2019)	(31/03/2020)
	Unaudited	Audited	Unaudited	Audited
Total income from operations	93.62	148.58	164.17	693.42
Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	16.62	20.14	0.22	21.13
Net Profit/(loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	16.62	20.14	0.22	21.13
Net Profit/(loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	11.37	15.51	0.22	16.30
Total comprehensive income for the period (comprising profit/loss for the period (after tax) and other comprehensive income (after tax))	11.37	15.51	0.22	16.30
Equity share capital	190.00	190.00	190.00	190.00
Reserves(excluding Revaluation) as shown in audited balancesheet of the previous year	0.00	0.00	0.00	0.00
Earnings per Share (of Rs. 10/- each)(for continuing and discontinued operations)-Basic & Diluted	0.60	0.82	0.01	0.86

NOTES

- The above is an extract of the detailed format of quarterly financial results for the quarter ended June 30, 2020 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited financial results are available on the Stock exchange websites (www.bseindia.com and nseindia.com) and on the Company's website (www.maitrienterprises.com).
- The financial results were reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the Company at their respective meetings held on 31/08/2020. The Statutory Auditors of the company have carried out the limited review in respect of the financial results for the quarter ended 30th June 2020.
- There are no separate reportable segments. The Company has only one reportably primary business segment.
- The Company has adopted Indian Accounting Standards ("Ind AS") from April 01, 2017 and the above financial results are prepared in accordance with the Companies (Indian Accounting Standard) Rules, 2015 (IND AS) prescribed under Section 133 of Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.
- The figures for the previous quarter/ year have been regrouped/reclassified wherever necessary to make them comparable.

For Maitri Enterprises Limited
SD/-
Jaikishan Ambwani
Managing Director
(DIN:03592680)

Date: 01.09.2020
Place: Ahmedabad

Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd Printed at- Mahadev Offset, H-47 Ravi Estate, Rustam Mill Compound, Dudheshwar, Ahmedabad-4. Published from 201-2, Nandan Com. Opp. Mithakhali Rly Crossing, Mithakhali, Ahd-6. Ed.: Mayur Bhatt

Karnataka CM flags off first ever RORO train between Bengaluru and Maharashtra's Solapur

Bengaluru, Karnataka chief minister BS Yediyurappa on Sunday flagged off first-ever Roll-On-Roll-Off (RORO) train between Bengaluru (Nelamangala) and Solapur in Maharashtra through video-conferencing.

